

પ્રાર્થુ

શ્વસો મારાં સર્વે શ્વસન મહીં હા શ્વાસ થઈને,
સ્કુરો મારાં સર્વે મનન મહીં હા ચિત્ત થઈને,
વસો મારાં સર્વે કરણ મહીં હા કર્મ થઈને,
લસો મારાં સર્વે સ્કુરણ મહીં કો મર્મ થઈને.

– સુન્દરમ્

તા: ૨૨-૩-૨૬ શ્રી સુન્દરમ્ ના જન્મદિને સ્મૃતિવંદના
સહિત

*It is never in vain
that an ardent and
sincere prayer is
addressed to the
Divine's Grace -
With blessings*

It is never in vain that an ardent and
sincere prayer is addressed to the
Divine's grace

With blessings
– **The Mother**

પ્રભુની કૃપાને કરેલી એક ઉત્કટ અને સાચી
પ્રાર્થના ક્યારેય નિરર્થક નથી જતી

આશીર્વાદ સાથે
– શ્રી માતાજી

Mantras of the Mother - 19 December 1954
શ્રી માતાજીના મંત્રો - ૧૯ ડિસેમ્બર ૧૯૫૪



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2026
MARCH
૧ માર્ચ, ૨૦૨૬

'DUE TO LACK OF FAITH...'
'શ્રદ્ધાના અભાવે...'

*If we had a truly living
faith, an absolute certitude
of the almighty power
of the Divine, His manifestation
could be so evident
that the whole earth
would be transformed
by it.
With my blessings*

If we had a truly living faith, an absolute certitude of the
almighty power of the Divine, His manifestation could be so
evident that the whole earth would be transformed by it.

With my blessings
– **The Mother**

આપણી શ્રદ્ધા જો સાચી રીતે જીવંત હોત, પ્રભુની સર્વશક્તિમત્તામાં
આપણો પૂરેપૂરો વિશ્વાસ હોત, તો પ્રભુનો આવિર્ભાવ એટલો સ્પષ્ટ બની
શકત કે એનાથી સમગ્ર પૃથ્વીનું રૂપાંતર થઈ જાત.

મારા આશીર્વાદ સાથે
– શ્રી માતાજી

Mantras of the Mother - 5 November 1954
શ્રી માતાજીના મંત્રો - ૫ નવેમ્બર ૧૯૫૪

THREE CONCEPTIONS OF THE WORLD.

1. BUDDHIST AND SHANKARA:

The world is an illusion, a field of ignorance and suffering due to ignorance. The one thing to do is to get out of it as soon as possible and to disappear into the original Non-Existence or Non-Manifestation.

2. THE VEDANTIC AS VERY COMMONLY UNDERSTOOD:

The world is essentially divine, for the divine is omnipresent there. But its exterior expression is distorted, obscure, ignorant, perverted. The one thing to do is to become conscious of the inner divine and remain fixed in that consciousness without troubling about the world; for this external world cannot change and will always be in its natural state of unconsciousness and ignorance.

3. SRI AUROBINDO'S VIEW:

The world, as it is, is not the divine creation it is meant to be, but an obscure and perverted expression of it. It is not the expression of the divine consciousness and will, but this is what it is meant to become; it has been created to develop into a perfect manifestation of the Divine under all His forms and aspects – Light and Knowledge, Power, Love and Beauty.

This is our conception of it and the aim we follow.

24-2-1936

THE MOTHER

FROM: 'A PRACTICAL GUIDE TO INTEGRAL YOGA.' – Ed. 1976

જગત વિષેની ત્રણ વિભાવનાઓ.

૧. બુદ્ધ અને શંકર:

આ જગત માયા છે, અજ્ઞાનનું ક્ષેત્ર છે અને અજ્ઞાનને કારણે દુઃખ છે. એક જ કાર્ય કરવાનું છે, જેટલું બને એટલું ત્વરાથી તેમાંથી નીકળી જવું અને મૂળ અ-સત્ કે શૂન્યમાં વિલીન થઈ જવું.

૨. વેદાન્ત: તદ્દન સામાન્ય રીતે જે સમજવામાં આવે છે.

જગત મૂળભૂત રીતે બ્રહ્મ છે, કારણકે બ્રહ્મ સર્વત્ર છે. પરંતુ તેની બાહ્ય અભિવ્યક્તિ વિરૂપ, અસ્પષ્ટ, અજ્ઞાનમય અને વિકૃત થયેલી છે. એક માત્ર ઉપાય એ છે કે, જગત વિષે ચિંતિત થયા વગર, આપણે આપણા અંતરમાં રહેલા પ્રભુ પ્રત્યે સભાન થવું અને તે ચેતનામાંજ સ્થિત રહેવું. કારણકે અ બાહ્ય જગત બદલાઈ શકવાનું નથી, અને તે હમેશાં તેની સ્વાભાવિક અજ્ઞાનમય અને અભાન અવસ્થામાં જ રહેવાનું છે.

૩. શ્રી અરવિન્દની દષ્ટિ:

આ જગત, જેવું છે તેવું, જે અર્થે તેને સર્જવામાં આવ્યું છે તેવું દિવ્ય સર્જન નથી, પણ તેની એક ધૂંધળી અને વિકૃત અભિવ્યક્તિ છે. આ જગત દિવ્યચેતના અને સંકલ્પની અભિવ્યક્તિ નથી પણ તદ્દઅર્થે જ તેને બનાવવામાં આવ્યું છે. જગતના સર્જનનો ઉદ્દેશ છે: પરમ પ્રભુનાં સર્વસ્વરૂપો અને પાસાંઓ - પ્રકાશ અને જ્ઞાન, શક્તિ, પ્રેમ અને સૌંદર્યના વિકાસ સહિત પ્રભુના પૂર્ણ આવિર્ભાવમાં વિકાસ પામવું. આ હેતુ માટે જગતનું સર્જન કરવામાં આવ્યું છે.

જગત માટેની આ અમારી વિભાવના, અમારો ખ્યાલ છે અને અમે તે ઉદ્દેશને અનુસરી રહ્યાં છીએ.

- શ્રી માતાજી

તા. ૨૪.૨.૧૯૩૬